



પાણવી ગ્રામરત્ન અને ચંક કાળ

નિયામક

ક્રમાંક: શાસીઈઆરટી/ફૂરવતી/દિલ્લી/2025/  
ગુજરાત શૈક્ષણિક સંસ્કોધન અને તાલીમ પરિષદ,  
વિદ્યાબાન, સેક્ટર - 12, જાંધીનગર  
ફોન: (079) 23256808 - 39  
ઈ-મેલ: goert12@gmail.com  
દેખાવાઈ: [www.goert.gujarat.gov.in](http://www.goert.gujarat.gov.in)  
તારીખ: / / 2025

પ્રતિ,

જિલ્લા શિક્ષણપદ્ધતિકરીશ્રી, તમામ

જિલ્લા પ્રાથમિક શિક્ષણપદ્ધતિકરીશ્રી, તમામ

શાસનપદ્ધતિકરી, તમામ

1 JUL 2025

**વિષય :** NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકસ તેમજ રમત-ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગવેસ તે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત

**સંદર્ભ:** (1) NEP 2020 પ્રકરણ નં. 4 મુદ્દા નં.4.9

(2) NCF-SE 2023 પ્રકરણ નં-8 મુદ્દા નં.8.2

(3) શાસીઈઆરટી સિંગલ ફાઇલ નં. 12/2025 પર તા. 19-6-2025 ની સરકારશ્રીની મંજુરી

શ્રીમાન,

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દેશમાં એવી શિક્ષણ પદ્ધતિની કલ્યાણ કરે છે જેનાં મૂળ ભારતીય સંસ્કારમાં હોય અને જેમાં તમામ ક્ષેત્રોમાં માનવીય પ્રયાસો અને શાનની સંસ્કૃતિજન્ય સિદ્ધિઓની વાત હોય, સાથે સાથે 21મી સદીની સંભાવનાઓ અને પડકારો સાથે રચનાત્મક રીતે જોગવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે. શાળાશિક્ષણ માટે આ મહત્વાકંક્ષી દર્શિકોણ માટેનો આધાર રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખા (NCF-SE) 2023 દ્વારા તમામ શૈક્ષણિક સ્તરે વિવિધ અભ્યાસક્રમ ક્ષેત્રોમાં સ્પષ્ટ રીતે મૂકવામાં આવ્યો છે.

NCF-SE 2023 એવાં કૌશલ્યોથી વિદ્યાર્થીઓને સર્જજ કરવાનું લક્ષ્ય ધરાવે છે, જે જીવનમાં આગળ વધવાની સાથે વિકસ માટે આવશ્યક છે. તે તેમની વિશ્વેષણાત્મક, વર્ણનપાત્રક અને અભિવ્યક્તિની ક્ષમતાઓ વધારવાનો પ્રયાસ કરે અને તેમને આવનારા પડકારો અને તકો માટે તૈયાર કરે છે. વિવિધતાસભર અભ્યાસક્રમમાં નવ વિષયો આવરી લેવામાં આવ્યા છે – ગ્રંથ ભાષાઓ, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ અને સુખાકારી તેમજ વ્યાવસ્થાપિક શિક્ષણ – જે તેમના સર્વાંગી વિકસનને પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NCF-SE) અનુસાર એક વિષયક્ષેત્ર ‘શારીરિક શિક્ષણ અને સુખાકારી’ છે. આ વિષયનો મુખ્ય ઉદ્દેશ શારીરિક પ્રવૃત્તિ અને રમતો પ્રત્યેનો રસ જગાવવાનો, રમતોમાં કુશળતાપૂર્વક જોગવાની ક્ષમતા વિકસાવવાનો અને સંઘર્ષો બાદ પણ ફરીથી ઊભા થવાની ક્ષમતા, સહાનુભૂતિ તથા સહકાર જેવાં માનવીય મૂલ્યો વિકસાવવાનો છે. ભારત પણે યોગની અદ્ભુત પરંપરા છે, જે માનસિક અને શારીરિક સુખાકારી માટે સંપૂર્ણ અનુભવ પ્રદાન કરે છે.

‘શારીરિક શિક્ષણ અને સુખાકારી’ વિષયમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને ધ્યાન જેવાં યોગનાં વિવિધ પાસાઓ ધોરજા 3 થી Secondary Stage સુધી વિકસાત્મક રીતે સામેલ કરવામાં આવ્યાં છે. આ સર્વગ્રાહી આરોગ્ય અને સુખાકારી માટે મજબૂત પાયો પૂરો પાડે છે.

બાલસભામાં સામૂહિક પ્રાર્થના વિદ્યાર્થીઓ માટે જીવનલક્ષી ગુણોની ખીલવહી માટે મહત્વપૂર્ણ છે. તે વિદ્યાર્થીઓને દિવસની શરૂઆત શર્ંતિ અને એકગ્રાત્ત સાથે કરવાની તક આપે છે. પ્રાર્થના વિદ્યાર્થીઓમાં આત્મવિશવાસ અને નૈતિક મૂલ્યો વિકસાવવામાં મદદ કરે છે.

સમૂહ કવાયત દ્વારા શારીરિક કૌશલ્યના વિકાસની સાથેસાથ શિસ્ત અને આજ્ઞાપાલનના ગુણ કેળવાય છે. સમૂહ કવાયતમાં હુકમ મળતાં કિયા કરવાની ત્વરિત નિર્ણયશક્તિ ખીલે છે.

આદ્યકણથી દુનિયાના દરેક દેશમાં રમતગમતનું સ્થાન મહત્વનું રહ્યું છે. રમત શરીરને પ્રવૃત્તિ આપે છે અને આરોગ્ય માટે ઉપકારક બને છે. રમત જીજે અજીજે પજ શક્તિ, ઝડપ અને નમનિયતા વગેરે જેવા ગુણો વિકસાવી શરીરમાં સુદૃઢતા, ચપળતા, સજાગતા અને નીડરતા વિકસાવવામાં મહત્વનો ફાળો આપે છે. હાલ ધોરજા 1 થી 8 માં રમતગમત માટે અઠવાડિયાના બે પિરિયડ હોય છે. ચિત્ર-સંગીતના અઠવાડિયાના એક એક પિરિયડ છે. મોયભાગની શાળાઓમાં શાનિવારે બાલસભાનું આયોજન કરવામાં આવે છે.

ગાંધિતિક રમતો, કોયડા ઉકેલ રમતો, જોડણી રમતો, સામાન્ય શાનની રમતો, મનોરંજક રમતો, ટાઇક્ડ સમસ્યા ઉકેલ રમતો વગેરે રમતો દ્વારા બાળકોનો માનસિક વિકાસ થાય છે.

NEP-2020 અને NCF-SE-2023 અનુસાર દરેક વિષયમાં અમુક શૈક્ષણિક મુદ્દાઓ પ્રોજેક્ટ વર્કથી ભષ્યાવદ્ય માટે નિયત કરેલ છે. પ્રોજેક્ટ વર્ક એ વિદ્યાર્થીઓ માટે એક વ્યવહારું, વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ છે જ્યાં વિદ્યાર્થીઓ વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવામાં અથવા જટિલ પ્રશ્નોનું અનેખાજ કરવામાં સહિયપણે જોડય છે.

ટેન બેગલેસ ડે અંતર્ગત પૂર્વ-ન્યાવસાયિક શિક્ષણ (ધોરજા 6 થી 8)માં આયોજન અને અમલીકરણનું સૂચન NEP-2020માં કરેલ છે. જેમાં બાળકોને રોજિંદા જીવનમાં યોગદાન આપતા વ્યવસાય/ વ્યવસાયકારોનો પરિચય કરાવવો, શાળામાં વર્ગિઝનની બધારની દુનિયા સાથે સંપર્ક કરાવવો, સ્થાનિક વ્યવસાયો, સ્થાનિક કારીગરો, શિલ્પીઓ, ગૃહઉદ્યોગો, લઘુઉદ્યોગો વગેરેની જીવકારી આપવી.

ટેન બેગલેસ ડેના કાર્યક્રમમાં સાક્ષરી વિષયોના વિષયવસ્તુને અનુભંગિત કરવા, સ્થાનિક વિવિધ વ્યવસાયોના મહત્વ પર ભાર મૂકવો, આ કાર્યક્રમ હેઠળ બાળકોને વધુમાં વધુ સ્થાનિક વ્યવસાયોના સંપર્કમાં લાવવાં, નિષ્ણાત વ્યક્તિઓ, સંસ્થાઓ અને સમુદ્દરાય સાથે જોડાણો, વિકસાવવાં, વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું અને તેમનું વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સાથે જોડાજ કરવું- આ તેમનાં મુખ્ય ધોય છે. જેમાંથી બાળકો અનુભવજન્ય શિક્ષણ પ્રાપ્ત કરે. શાળાની વિષયો અને જીવન વ્યવહારોના અનુભવોનું જોડાજ સમજે.

ક્ષેત્રીય મુલાકૃત દ્વારા નિખાતોના શાન અને અનુભવોનો લાભ મળે. વિવિધ વ્યવસ્થાઓનો ક્રોશલ્ય કેળવવાની તક પ્રાપ્ત કરે. દરેક વ્યવસ્થા પ્રત્યે આદરભાવ કેળવે ભાવિ કારક્રમી માટે વ્યવસ્થા પસંદગીનો અવકાશ મળે. જુદા જુદા વ્યવસ્થાઓ/વ્યવસ્થાની સમજ કેળવે તથા સમૂહભાવના, નેતૃત્વ અને સામાજિકતા વગેરે જેવા ગુણ વિકસે.

RTE Act-2009 તેમજ RTE Rules-2012 મુજબ સરકારશીના તા.14/07/2011ના શિક્ષણ વિભાગના છાચ ક્રમાંક NO:GH/SH/31/2011/JSB/1186/N થી જાહેરાતીને એકેદેશીક ઓથોરીટી જાહેર કરવામાં આવેલ છે.

આમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020, ભારતીય શિક્ષણ પ્રકાલીમાં આમૂલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી છે. આ નીતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું શાન આપવાને બદલે તેમનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ ચંદ્રભૂમાં, ‘આનંદદાયી શનિવાર’ (Joyful Saturday) દર્શિતર વગરના 10 દિવસ (10 Bag-less Days) મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, જે બાળકોને પરંપરાગત અધ્યયન-અધ્યાપનમાંથી મુક્તિ આપી, વિવિધ સર્જનાત્મક અને શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા શીખવાની તક આપે છે. આ દિવસો બાળકો કોઈપણ જાતના શૈક્ષણિક ભારણ વિના આનંદ અને ઉલ્લાસ સાથે શીખી શકે છે.

આનંદદાયી શનિવાર અંતર્ગત શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કરવાની છે:

- માસ ડ્રિલ (Mass Drill): શનિવારની શરૂઆત સામૂહિક ડ્રિલથી કરી શકાય છે. આમાં શારીરિક કસરતો, પીઠી (Physical Training) અને શિસ્તબદ્ધ હલનચલનનો સમાવેશ થાય છે. આનાથી બાળકોમાં શારીરિક સર્જનાત્મક, સહયોગ અને સમૂહ ભાવનાનો વિકાસ થાય છે.
- યોગ (Yoga): યોગ એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. બાળકોને સરળ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન શીખવાં આનાથી તેમની એક્ષગ્રતા વધે છે, તણ્ણવ ઓછો થાય છે અને શારીરિક લવચીક્રતા (નમનીયતા) આપે છે. NEP 2020 પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે, જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો સમાવેશ થાય છે.
- બાલસભા અંતર્ગત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (Cultural Activities): બાળકોને ભારતીય સાંસ્કૃતિક અને કલા સાથે જોડવા માટે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું. આમાં લોકનૃત્ય, ગીતો, નાટકો, વાર્તાકથન અને દેશભૂષણ વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો તેમની સર્જનાત્મક કલાકૃતિ રજૂ કરે તેવું આયોજન કરવું.
- શૈક્ષણિક રમતો (Educational Games): રમતો દ્વારા શિક્ષણ એ NEP 2020 નો એક મહત્વપૂર્ણ ભાગ છે. આનંદદાયી શનિવારે, ગણિત, વિજ્ઞાન, ભાષા વગેરે સંબંધિત શૈક્ષણિક રમતો રમાડવી. આ રમતો દ્વારા બાળકો મનોરંજનની સાથે શાન પણ મેળવે છે અને તેમની શીખવાની પ્રક્રિયા વધુ રસપ્રદ બને છે.

- **પ્રોજેક્ટ્સ (Projects):** બાળકોને જૂથમાં કે વ્યક્તિગત રીતે નાના પ્રોજેક્ટ્સ પર કામ કરવા પ્રોત્સાહિત કરવાં. આમાં પર્યાવરણ, વિશ્વાનન્દ સરળ પ્રયોગો, કલા આધ્યાત્મિક પ્રોજેક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. આનાથી તેમની સમસ્યા હલ કરવાની ક્ષમતા, સહયોગ અને સંશોધન વૃત્તિ વધી છે.
- **ચિત્રકામ (Drawing):** ચિત્રકામ બાળકોની કલ્યાણાશાહીત અને સર્જનાત્મકતાને વેગ આપે છે. બાળકોને વિવિધ વિષયો પર મુક્તપણે ચિત્રકામ કરવાનું કામ આપવું.
- **સંગીત (Music):** સંગીત બાળકોના મનને શાંતિ અને આનંદ આપે છે. તેમને ગીતો ગાવા, વાદ્યો વગાડવા અથવા સંગીત સંભળવા પ્રોત્સાહિત કરવાં. ગીત-સંગીતના કાર્યક્રમો પક્ષ યોજવા.
- **આમની નજીકનાં સ્થળોની મુલાકાત:** NEP 2020 સ્થાનિક જ્ઞાન અને સમુદ્ધાય સાથેના જોડજી પર પક્ષ ભાર મૂકે છે. બાળકોને ગામની નજીકનાં ઐતિહાસિક સ્થળો, ખેતરો, તળાવ, ટાપાલ કચેરી, બેંક, પોલિસ સેટેશન અથવા નાના ઉદ્યોગોની મુલાકાત કરાવી શક્ય. આનાથી તેમને વ્યવહારિક જ્ઞાન મળે છે અને તેઓ પોતાના સમુદ્ધાય વિશે વધુ શીખે છે.

**બાળકોને મોબાઈલથી દૂર રાખવાની જરૂરિયાત અને તેમાં ‘આનંદદાયી શનિવાર તથા 10 બેગવેસ તેની ભૂગિકા:**

આજના યુગમાં, બાળકોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકસન પર નકારાત્મક અસર પડે છે:

- **શારીરિક સમસ્યાઓ:** અંખો પર તાણ, માથાનો દુખાવો, ઊંઘનો અભાવ, સ્થૂળતા અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ.
- **માનસિક સમસ્યાઓ:** એકાગ્રતાનો અભાવ, ચીરિયાપણું, ડિપેશન, ચિંતા અને શીખવાની ક્ષમતામાં ઘટાડે.
- **સામાજિક સમસ્યાઓ:** સામાજિક કૌશલ્યોનો અભાવ, એકલતા, વાસ્તવિક દુનિયાથી વિમુખતા.

‘આનંદદાયી શનિવાર અને દફ્ફતર વગરના 10 દિવસ’ બાળકોને મોબાઈલથી દૂર રાખવામાં અત્યંત મહદુમ થઈ શકે છે. જ્યારે બાળકો વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓમાં વસ્ત હોય છે, ત્યારે તેમને મોબાઈલનો ઉપયોગ કરવાની ઈચ્છા થતી નથી. શારીરિક રમતો અને સામૂહિક પ્રવૃત્તિઓ તેમને સક્રિય રાખે છે અને સામાજિક રીતે જોડે છે.

સર્જનાત્મક કાર્યો તેમને પોતાની કલ્યાણાશાહીતનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. ગામનાં સ્થળોની મુલાકાત તેમને વ્યવહારિક દુનિયા સાથે પરિચિત કરાવે છે, જે મોબાઈલના વર્યુઅલ વિશ્વથી તદ્દન અલગ છે.

આ રીતે, ‘આનંદદાયી શનિવાર અને દફ્તર વગરના 10 દિવસ’ બાળકોને મોખાઈલના વ્યસનથી મુક્ત કરી, તેમને વાસ્તવિક દુનિયામાં જીવવાનો, શીખવાનો અને વિકાસ કરવાનો સુવર્ણ અવસર પૂરો પાડે છે.

“મેદસિવતામુક્ત ભારત” અભિયાન અંતર્ગત ‘આનંદદાયી શનિવાર અને દફ્તર વગરના 10 દિવસ’ અત્યંત અસરકારક અને ઉપયોગી સાધિત થઈ શકે છે. મેદસિવતા આજે વૈશ્વિક સ્તરે એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની આઈ છે, અને ખાસ કરીને બાળકોમાં તેનું પ્રમાણ વધી રહ્યું છે. બેશ્વરું જીવનશૈલી, ફાસ્ટ ફૂડનું વધતું ચલણ અને ડિજિટલ ઉપકરણોનો અતિશાય ઉપયોગ આ સમસ્યાનાં મુખ્ય કારણો છે. આવા સમયે, ‘આનંદદાયી શનિવાર અને દફ્તર વગરના 10 દિવસ’ બાળકોને સક્રિય અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરીને ‘મેદસિવતામુક્ત ભારત’ ના ધ્યેયને સિદ્ધ કરવામાં મહત્વનો ફાળો આપી શકે છે.

- માસ ડ્રિલ અને યોગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા ઊર્જાનો વપરાશ થાય છે અને કેલરી બર્ન થાય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. યોગ મેટાબોલિઝમ (ચયાપચય)ને પણ સુધારે છે અને શરીરને વધુ કાર્યક્ષમ બનાવે છે.
- પરંપરાગત રમતો જેવી કે ખો-ખો, કબજી, દોડ, લાંબીકૂદ-ઊંચીકૂદ, દોરડકૂદ વગેરે બાળકોને શારીરિક રીતે સક્રિય રાખે છે.
- જ્યારે બાળકો શારીરિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય છે, ત્યારે તેમનો સ્કીન ટાઇમ કુદરતી રીતે ઘટી જાય છે. વધુ પડતો સ્કીન ટાઇમ બેશ્વરું જીવનશૈલી અને મેદસિવતા સાથે સીધો સંબંધ ધરાવે છે.
- મેદસિવતા ઘણીવાર તણાવ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે પણ સંકળાયેલી હોય છે. આનંદદાયી શનિવારે થતી મનોરંજક પ્રવૃત્તિઓ, સંગીત, ચિત્રકામ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બાળકોના મન પરનો તણાવ ઘટાડે છે અને તેમને ખુશ અને હળવા રાખે છે.
- આનંદદાયી શનિવાર દરમિયાન, આરોગ્ય અને પોષણ સંબંધિત શૈક્ષણિક રમતો અથવા નાના પ્રોજેક્ટ્સ દ્વારા બાળકોને સ્વસ્થ આખાર અને નિયમિત કસરતના ફાયદા વિશે જાગૃત કરી શકાય. તેમને ફાસ્ટ ફૂડના ગેરફાયદા અને તાજાં ફળો-શાકભાજના મહત્વ વિશે સરળ ભાષામાં સમજાવી શકાય.
- બાળપણમાં જે આદતો પડે છે, તે ભૂવિષ્યમાં પણ ચાલુ રહે છે. ‘આનંદદાયી શનિવાર અને દફ્તર વગરના 10 દિવસ’ દ્વારા બાળકોને નાનપણથી જ શારીરિક પ્રવૃત્તિ, યોગ અને શારીરિક રીતે સક્રિય રહેવાની આદત પડે છે, જે તેમને આજીવન સ્વસ્થ રહેવામાં મદદરૂપ થશે અને મેદસિવતા જેવી સમસ્યાઓથી દૂર રાખશે.

**શારીરિક શ્રમના ગૌરવ માટે 'આનંદદાયી શનિવાર અને દફ્તર વગરના 10 દિવસ' કેવી રીતે ઉપયોગી બને છે?**

'શારીરિક શ્રમનું ગૌરવ' એટલે કોઈપણ પ્રકારના શારીરિક કાર્યને આદરની દર્જિઓ જોવું, ભલે પછી તે મહેનતનું કારીગરીનું કે રોજિંદા કામકાજનું હોય. આનો અર્થ એ કે સમાજમાં માનસિક કાર્ય જેટલું જ શારીરિક કાર્યને પણ મહત્વ અને સન્માન મળવું જોઈએ. NEP 2020 (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020) આ ઘ્યાલને ભારતીય શિક્ષણ પ્રણાલીમાં સમાવવા પર ભાર મૂકે છે, જેથી બાળકો નાનપણથી જ શ્રમનું મહત્વ સમજે અને કોઈપણ કામ પ્રત્યે લેદાખાવ ન રાજે.

'આનંદદાયી શનિવાર અને દફ્તર વગરના 10 દિવસ' બાળકોને શારીરિક શ્રમના ગૌરવનો અનુભવ કરાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ દિવસો યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને વ્યવહારિક રીતે શારીરિક મહેનતનું મહત્વ સમજાય છે અને તેના પ્રત્યે આદરભાવ કેળવાય છે:

- બાળકામ/બેતીકામ:** બાળકોને શાળાના બગીચામાં કે નાના ખેતરમાં વાવણી, નિંદામણ, પાણી પાવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ કરી શકાય. આનાથી તેમને સમજાય છે કે અનાજ કે શાકભાજ ઉગાડવા પાછળ કેટલી મહેનત હોય છે. તેઓ પ્રકૃતિ સાથે જોડાય છે અને શ્રમનું મહત્વ સમજે છે.
- મારીનાં વાસણ બનાવવાં, વાકડાની વિવિધ વસ્તુઓ બનાવવી, લોખંડનાં ખેત ઓજારો બનાવવાં આદું ઇલેક્ટ્રિક કાર્ય વગેરે જેવાં કામના નાના નમૂના (ઓડેલ) બનાવવા. આનંદદાયી શનિવારે આવાં કાર્યો શીખવવાથી બાળકો કારીગરોના કામને સમજે છે અને તેના પ્રત્યે સન્માન અનુભવે છે. તેઓ એ જાણો છે કે રોજબરોજ વપરાતી વસ્તુઓ કંઈ રીતે બને છે અને તેમાં કેટલી મહેનત લાગે છે.**
- સંજ્ઞાઈ અભિયાન:** શાળા પરિસર કે ગામમાં નાના પાયે સંજ્ઞાઈ અભિયાન ચલાવવું. બાળકો જાતે કચરો ઉક્ખાવે, સંજ્ઞાઈ કરે તો તેમને સ્વચ્છતાનું મહત્વ અને સંજ્ઞાઈ કામદારોના શ્રમનું ગૌરવ સમજાય છે.
- બાળકો પોતાના હાથે કોઈ કાર્ય કરે અને તેનું પરિણામ જુઓ ત્યારે તેમને આત્મસંતોષ મળે છે. ઉંદાહરણ તરીકે, જો તેઓ બાળકામ કરે અને છોડ ઉંગે, તો તેમને પોતાની મહેનતનું ફળ દેખાય છે. આનાથી તેમનામાં આત્મનિર્ભરતા અને જવાબદારીની ભાવના કેળવાય છે.**

શારીરિક શ્રમ કરવાથી બાળકોનો શારીરિક વિકસન થાય છે. તેમની માંસપેશીઓ મજબૂત બને છે, સહનશક્તિ વધે છે અને એકંદરે સ્વાસ્થ્ય સુધરે છે. આ સાથે, હાથથી કામ કરવાથી તેમનું મગજ પણ સંક્રિય રહે છે, જે માનસિક વિકસનમાં મદદ કરે છે.

- પ્રોજેક્ટ્સ અને કારીગરીનાં કાર્યોમાં સમસ્યા ઉકેલાની કુશળતા (problem-solving skills) વિકસે છે.**

- જ્યારે બાળકો વિવિધ પ્રકારના શ્રમનો જીતે અનુભવ કરે છે ત્યારે તેઓ કોઈ ચોક્કસ કામને નીચું કે ઊચું ગણવાની માનસિકતામાંથી બહાર આવે છે. તેઓ સમજે છે કે સમાજમાં દરેક પ્રકારના શ્રમનું પોતાનું મહત્વ છે અને દરેક શ્રમિકનું સન્માન થવું જોઈએ. આનાથી સમાજમાં સમાનતા અને સહિભૂતા વધે છે.

10 બેગલેસ ડે નિભિતે કરવાની પ્રવૃત્તિઓની વિગતો સમગ્ર શિક્ષા દ્વારા આ અગ્રાઉ આપવામાં આવેલ છે. આ ઉપરાંત, GCERT દ્વારા આ અંગે એક મોડ્યુલ બનાવવામાં આવનાર છે અને ટૂંક સમયમાં શાળાદીઠ એક શિક્ષકને તાલીમ આપવાનું આપોજન કરવામાં આવેલ છે. આ અંગે જુલાઈ માસથી આ સત્રના કુલ 8 શનિવાર 'આનંદદાયી શનિવાર' તેમજ 4 શનિવાર 'બેગલેસ ડે' ની પ્રવૃત્તિઓ કરવા આથી જણાવવામાં આવે છે.

આ અંગેની જાણ આપના હસ્તકની સરકારી, અનુદ્ઘાનિત તેમજ બિન અનુદ્ઘાનિત તમામ પ્રાથમિક શાળાઓને કરવા આથી જણાવવામાં આવે છે.

'આનંદદાયી શનિવાર અને દફ્તર વગરના 10 દિવસ' અંતર્ગત પ્રવૃત્તિઓ કરવા માટે સંદર્ભ ત અંતર્ગત સરકારશ્રીની મળેલ મંજૂરી અન્વયે જણાવવામાં આવે છે.

(પ્રકાશ કે. નિતિન પટેલ)

નિયામક

જાનીઈઆરટી, ગાંધીનગર

#### નકલ સેવનય રવાના જાણ સારૂ:

- માન. મંત્રીશ્રી (શિક્ષણ)ના અંગત સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ-1, નવા સચિવાલય, ગાંધીનગર
- માન. રા.ક.મંત્રીશ્રી (શિક્ષણ)ના અંગત સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ-2, નવા સચિવાલય, ગાંધીનગર
- માન. અગ્રસચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ના અંગત સચિવશ્રી, ગાંધીનગર
- માન. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, સમગ્ર શિક્ષણ, ગાંધીનગર
- માન. નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર

#### નકલ રવાના યોગ્ય કાર્યવાહી સારૂ:

- પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તમામ
- તાલુક પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તમામ (ભારફ્ત સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી)
- બી.આર.સી., યુ.આર.સી., સી.આર.સી. કો-ઓ.ઇનિટરશ્રી તમામ (ભારફ્ત સંબંધિત જિલ્લા પ્રોજેક્ટ કો-ઇનિટરશ્રી)
- કેળવણી નિરીક્ષકશ્રી તમામ (ભારફ્ત સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી)
- આચાર્યશ્રી, સરકારી, અનુદ્ઘાનિત તેમજ બિન અનુદ્ઘાનિત પ્રાથમિક શાળાઓ તમામ (ભારફ્ત સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/ શાસનાધિકારીશ્રી)